

26 ફેબ્રુઆરી 2019

બ્રમ્પટન ઉજવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન

બ્રમ્પટન, ઓન્ટારિયો (26 ફેબ્રુઆરી 2019) – નાગરિકો અને મુલાકાતીઓને ગુરુવાર, 07 માર્ચ 2019ના રોજ સાંજે 04:30 થી 6 બ્રમ્પટન સીટી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

સીટી ઓફ બ્રમ્પટન અને ઝોન્ટા ક્લબ ઓફ બ્રમ્પટનના (Zonta Club) યજમાનપદે પ્રસંગનો પ્રારંભ ડેઈલિ ટાઈમ સ્ક્વેરથી સીટી હોલ એટ્રિયમ સુધીની શોભાયાત્રા અને સ્મર્જિંગ સેરેમનીથી પ્રારંભ થશે.

સીટી હોલ એટ્રિયમમાં હાજર રહેલ લોકો શ્રેણીબદ્ધ વક્તાઓ પ્રસ્તુતિઓ અને સ્થાનિક મહિલા સંગઠનો પાસેથી માહિતી મેળવવાનો લાભ લઈ શકશે જેમાં સામેલ છે:

- સિટી ટીવીનાં એમસીસ ક્રિસ્ટિના હોવરન (Cristina Howorun) અને ટેમ્મિ સુથરલેન્ડ (Tammie Sutherland)
- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown), રિજનલ કાઉન્સિલર રોવેના સાન્તોસ (Rowena Santos) અને સીટી કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams)નું સ્વાગત સંબોધન
- સાહસિક બિસ્મા હૈદર (Bisma Haider)નું કિનોટ વ્યાખ્યાન CBCના ડ્રેગન્સ ડેન (Dragon's Den) પર દર્શાવવામાં આવશે
- બ્રમ્પટન સિટિઝન એવોર્ડ વિજેતા, લામોઈ સિમન્ડ્સ (Lamoi Simmonds) દ્વારા સ્પોકન વર્ડ (Spoken Word)
- વોલિસ ફોર વેલનેસ (Wallis for Wellness)ના માર્ગરેટ વોલિસ-ડફી (Margaret Wallis-Duffy) સાથે ઈન્ટરએક્ટિવ સેશન
- નોર્થ પાર્ક અને સેન્ટ્રલ પીલ સેકન્ડરી સ્કૂલ્સની ઝોન્ટા ક્લબ (Zonta Club) વિદ્યાર્થીનીઓ રેચલ લિમ (Rachel Lim) અને એલિયા અબિદી (Ellia Abidi) દ્વારા રજૂઆતો
- SAMA મોડેલ્સ, અને નોર્થન લાઈટ્સ સ્ટ્રિંગ ક્વાર્ટિટ (Northern Lights String Quartet)ના હદાસા અનોર (Hadassah Annor), રોઝી કૌર ચૌહાન (Rosey Kaur Chohan)ના મંચ પર પ્રયોગો
- ઝોન્ટા ક્લબ ((Zonta Club))નું સાલ્વેશન આર્મી ફેમિલિ લાઈફ રિસોર્સ સેન્ટરને (Salvation Army Family Life Resource Centre) ચેકનું અર્પણ

"આપણાં શહેરમાં મહિલાઓ દ્વારા ભજવાતી મહત્વની તમામ ભૂમિકાઓને બિરદાવવા બ્રમ્પટન તેનો પ્રથમ જાહેર આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવી રહ્યો છે. આ પ્રસંગ એક એવી તક ઊભી કરશે જેથી અહીં બ્રમ્પટન ખાતે, આખા કેનેડામાં અને વિશ્વભરમાં જે કંઈ પણ મહિલાઓ દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે તેને બિરદાવી શકાય" એવું મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)એ જણાવ્યું હતું.

તમામ નાગરિકોને આહવાન કરવામાં આવે છે કે Twitter અને Instagram પર હેશટેગ #WomenofBramptonનો ઉપયોગ કરી સીટીને મહિલાઓનો સન્કાર કરવામાં મદદ કરે. સીટીની ચેનલો પર તમારી સામગ્રી શેર કરવા માટે હેશટેગ #WomenofBrampton અને [tag @eventsbrampton on Instagram](#), અથવા [@Brampton Events on Twitter](#)નો ઉપયોગ કરી તમને પ્રેરણાદાયી લાગતી મહિલા વિશે એક ટૂંકું વિધાન (15 અથવા ઓછા શબ્દ) સમેત તેમની તસ્વીર અથવા વીડિયો પોસ્ટ કરો.

જ્યારે એક વૈજ્ઞિક રીતે સંતુલિત વિશ્વની માંગ ઊઠી છે ત્યારે મહિલાઓએ હાંસલ કરેલ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સિદ્ધિઓને બિરદાવવા આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવામાં આવે છે. 2019ની ઝુંબેશની થીમ #BalanceforBetter છે.

પ્રસંગ વિશે વધુ જાણકારી માટે [અહીં ક્લિક કરો](#).

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિશે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગોરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર અને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca